

અરજી પત્રક ઓન-લાઈન ભરવા માટેની સુચનાઓ:

1. વિદ્યાસહાયક ભરતી અંગેનું ઓન-લાઈન અરજી પત્રક વેબસાઈટ <http://vsb.dpegujarat.in> ઉપરથી તા.૦૬/૦૪/૨૦૨૧ સવારના ૧૧:૦૦ કલાકથી તા.૧૮/૦૪/૨૦૨૧ ના રોજ બપોરના ૧૫:૦૦ કલાક સુધી ભરી શકાશે.
2. અરજીપત્રક ભરતા પહેલા વેબસાઈટ ઉપર મુકવામાં આવેલ ઉમેદવારો માટેની સુચનાઓ, ઠરાવો, પરિપત્રો અને પત્રકોનો કાળજીપૂર્વક અભ્યાસ કરવો.
3. અંગ્રેજી અને હિન્દી માધ્યમની ખાલી જગ્યાઓ માટે ગુજરાત રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા લેવાયેલ ટેટ પરીક્ષા પાસ કરેલ હોય તે જ ઉમેદવારો 'ઓનલાઈન' અરજી કરી શકશે.
4. અંગ્રેજી અને હિન્દી માધ્યમ સિવાયના ઉમેદવારોએ કે જેઓએ CTET અને અન્ય રાજ્યમાંથી ટેટ પરીક્ષા પાસ કરેલ હોય તે માધ્યમમાં અરજી કરી શકશે.
5. ઉમેદવારોએ સૌથી પહેલાં રજિસ્ટ્રેશન લિન્ક ઉપરથી પોતાની વિગતો ભરી રજિસ્ટ્રેશન કરવાનું રહેશે. ત્યાર બાદ લોગિન થયેથી અરજીપત્રક ખુલશે.
6. ઓનલાઈન અરજીપત્રકની વિગતો કોલમ મુજબ ક્રમશઃ ભરી અરજીપત્રક Save કરવાનું રહેશે. ઓનલાઈન Save કર્યા બાદ અરજીપત્રક સાથે જરૂરી લાગુ પડતાં તમામ આધાર/પુરાવાઓ ઓનલાઈન અપલોડ કરવાના રહેશે. ત્યાર બાદ અરજીપત્રકની પ્રિન્ટ મેળવી લેવાની રહેશે.
7. ઓન-લાઈન ભરેલું ફોર્મ કમ્પ્યુટર ઉપર SAVE કરતાં પહેલાં તે માહિતી ઓન-લાઈન ચકાસી લેવી અને ભરેલા ફોર્મમાં કોઈપણ ફેરફાર કરવો હોય તો તે કરી લેવો. એકવાર સ્વીકાર કેન્દ્ર કક્ષાએ અરજીપત્ર Final Submit થયા બાદ તેમાં સુધારો કરી શકાશે નહીં.
8. અરજી પત્રકની પ્રિન્ટ કરેલી કોપી નક્કી કરેલ સ્વીકાર કેન્દ્રો ઉપર તા.૦૬/૦૪/૨૦૨૧ થી તા.૧૮/૦૪/૨૦૨૧ (રવિવાર અને જાહેર રજા સિવાય) સુધી રૂબરૂમાં સવારના ૧૧:૦૦ કલાકથી સાંજના ૫:૦૦ કલાક સુધી સ્વીકારવામાં આવશે.
9. પ્રિન્ટ કરેલા ફોર્મમાં કોઈપણ જાતના સુધારા-વધારા કે છેકછાક કરેલા ફોર્મનો સ્વીકાર કરાશે નહિ. આમ છતાં જિલ્લા કક્ષાએ Final Submit થયા બાદ પણ જો કોઈ સુધારો કરવાની જરૂર જણાય તો કામ-ચલાઉ મેરીટ યાદી પ્રસિધ્ધ થયા બાદ ક્ષતિ સુધારણામાં ઓનલાઈન ક્ષતિ સુધારણા ફોર્મ મેળવી સુધારો કરી શકાશે. પરંતુ નવિન વિગત/માહિતી/લાયકાત ઉમેરી શકાશે નહીં.
10. સ્વીકાર કેન્દ્રની યાદી વેબસાઈટ <http://vsb.dpegujarat.in> ઉપર મુકવામાં આવેલ છે.
11. અરજીપત્રકની હાર્ડકોપી રાજ્યના નક્કી કરેલ સ્વીકાર કેન્દ્ર ઉપર જરૂરી અસલ ગુણપત્રકો/પ્રમાણપત્રો સાથે ચકાસણી કરાવી, નિયત કરેલ ફી ભરી, સહી કરેલી પહોંચ જરૂરથી મેળવવી, અને સ્વીકાર કેન્દ્ર મારફત અરજી પત્રક Final Submit કરાવવું. Final Submit થયા સિવાયનું કોઈપણ અરજી પત્રક ગ્રાહ્ય રાખવામાં આવશે નહીં.
12. અરજી પત્રક Final Submit કર્યા બાદ સ્વીકાર કેન્દ્ર દ્વારા આપવામાં આવેલ સ્વીકારનારની સહીવાળી પહોંચ મેળવી સાચવવી, અને પસંદગી સમયે અચુક સાથે લાવવી.
13. સ્વીકાર કેન્દ્ર અથવા ભરતી કાર્યાલયની કચેરીએ ટપાલ કે કુરીયર મારફતે અરજી ફોર્મ સ્વીકારવામાં આવશે નહીં. રજૂ થયેલ અરજીપત્રો રદ ગણાશે.

તા.૩૦/૦૩/૨૦૨૧

સ્થળ:-ગાંધીનગર

જાહેરાત ક્રમાંક.વિસભ:૦૧-૦૨/૨૦૨૧

ડૉ. એમ.આઈ.જોષી

અધ્યક્ષ

ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષણ પસંદગી સમિતિ અને

પ્રાથમિક શિક્ષણ નિયામક,

ગુજરાત રાજ્ય ગાંધીનગર.